https://archive.org/details/bk1033/page/n0/mode/1up

2019-08-05 -Satpanthi Lonavala Letter to spread Fake News (1033)

All Items on https://archive.org/details/realpatidar

શ્રી લક્ષ્મી નારાયણાયે નમ: શ્રી ઉમીયા માતાયે નમ:

લોનાવલા.તા.૫-૮-૧૯.

realpatidar.com

શ્રી અખીલ ભારતીય કચ્છ કડવા પાટીદાર, સનાતન સમાજ, નખત્રાણા, કચ્છ.
લખનાર લોનાવલાથી મુંબાઈના સનાતન સમાજનું એક યુવક મંડળ.

જય શ્રી ઉમીયા માતાજી સાથે જણાવવાનું કે, અમો અખીલ કચ્છ કડવા પાટીદાર, સનાતન સમાજના જ સભ્યો છીએ. આપણી પાટીદાર સમાજમાં જે,સનાતન તથા સતપંથ સમાજોમાં જે,ધર્મના નામે ઝઘડાઓ ચાલી રહ્યા છે.તેમાં અમો નવ-દશ વર્ષથી બંન્ને સમાજોનો અભ્યાસ કરી રહ્યા છીએ. સતપંથ ધર્મમાં જે સુધારાની જરૂર હતી,તે સુધારા થઈને એ વેદ અને સનાતન ધર્મના આધારે યોગ્ય બન્યું છે. પરંતુ આપણા સનાતન ધર્મમાં નથી કોઈ શાસ્ત્રો. અને નથી કોઈ ચોક્કસ ધર્મના નિતી નિયમો.તેથી નથી સનાતન સમાજનો કોઈ સાચી ડીસા. તેથી જ સનાતન સમાજ વિવેકનો માનવતા મુકી મનફાવે તેમ,એ સતપંથની નીંદા કરી પાપ વોરી રહી છે. તેનું અમોને દુ:ખ છે. સનાતનનું આજે બહુમત હોવાથી સતપંથ માટે ખોટા નિયમ બનાવી રહી છે. તેથી સમાજની નિયાણીંયું બહુ દુ:ખી છે.તો એ નિયાણીંયુંએ સમાજનું શું બગાડયું છે કે,વિવાહ જેવા સુભ પ્રસંગમાં, બેનના ઘરે જો ભાઈ પ્રેમથી ટાઈમ પર આવી ન શકે.અને ટાઈમ ઉપર મામેરૂં પણ આપી ન શકે તો,એ ચોખે ચોખો અન્યાય છે. આથી નિર્દોષ નિયાણીંની હાય સમાજનો જરૂર લાગવાની છે. માટે એ ભોગવવું જ પડશે. બીજુ સતપંથી સાથે ધંધાકીય વ્યવહાર કરવા નહીં.અને તેમની સાથે ભાગીદારી કરવી નહીં.અને જો હોય તો,તે ભાગીદારી છુટી કરી લેવી. આવા આવા અનેક ખોટા નિયમો બનાવી વિવેક અને માનવતા વિરૂદ્ધના નિયમો બનાવે છે. તેથી સનાતન સમાજનો સુજયું છે કે શું, એ જ સમજાતું નથી.અને આપે કહીએ છીએ કે, સનાતન સમાજે જો,શ્રી લક્ષ્મી નારાયણ સનાતન ધર્મ અપનાવ્યો નાં હોત,તો આજે આપણી પાટીદાર સમાજ મુસલમાન બની ગઈ હોત.પરંતુ હકીકતમાં એનાથી આજે બધું જ ઉંધુ બની રહ્યું છે.કારણ આપે સતપંથ મુકીને શ્રી લક્ષ્મી નારાયણ સનાતન ધર્મ અપનાવ્યો છે.તેથી જ આપણા નવયુવાનિયાઓ આજે ના ખાવાનું,કે ન પીવાનું,મુસલમાન સાથે બેસી ખાઈ પી રહ્યા છે.ત્યારે સતપંથમાં આવું કાંઈપણ નથી. આવી વસ્તુથી સતપંથી દુર રહે છે.તો મુસલમાન કોણ બની રહ્યું છે. આપે કે સતપંથી ? તેનો વિચાર કરવા જેવો છે. સાચા સતપંથીઓ તો હોટલનું પાણી પણ પીતા નથી.તેથી જ તે પોતાનું હિન્દુત્વ સાચવી રહ્યા છે.ત્યારે આપે ના ખાવાનું ને ન પીવાનું પીને, આપે હિન્દુત્વ ગુમાવી રહ્યા છીએ. દારૂથી તો અનેકનાં ઘર બદબાદ બની રહ્યા છે.છતાં આપણી આંખો ખોલતી નથી. ખરેખર સતપંથ મુકવાથી જ આપણા આવા હાલ થયા છે, સમજી લેજો. તો કયાં ગયું આપણું હિન્દુત્વ, કે જે હિન્દુત્વ માટે આપે સતપંથ ધર્મનો છોડયો છે.

કળીયુગમાં નારાયણ વિષ્ણુંવેદ આધારે,અને સનાતન ધર્મના આધારે,દશમાં રૂપે શ્રી કલ્કી ભગવાનના રૂપમાં થવાના છે. તેથી સતપંથી આજે પુજે છે. છતાં પણ આપે સતપંથની નીંદા કરી રહ્યા છીએ. તેથી જ આપણું નુકશાન છે.કારણ સતપંથ ઉપર ખોટા વ્યવહારીક દબાણો મુકી,સતપંથીઓનો ધર્મ છોડવી,અને આપે શ્રી કલ્કી ભગવાનનાં મંદિર બંધ કરાવી રહ્યા છીએ.માટે એ ભોગવવું જ પડશે.તો હંમેશા ધર્મનો જય થાય છે.અને અધર્મનો નાશ થાય છે. શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે, જયારે જયારે ધર્મની હાની થાય છે.અને અધર્મની વૃધ્ધિ થાય છે.ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરૂં છું.ત્યારે સતપુરૂષોનું રક્ષાણ કરવા,દુષ્ટોનો નાશ કરવા,અને ધર્મનો ફરી સ્થાપવા યુગે યુગે હું પ્રગટ થાઉં છું. પાંડવોની અજ્ઞાત વાસમાં વેરાટ નગરીમાં, શ્રી કૃષ્ણ આજના ધોળકા ગામે પાંડવોને મળવા ગયા હતા.ત્યારે ધોળકાની નજીકમાં ગીરમટા ગામે અને સાબરમતી નદીના પુર્વ કિનારે,શ્રી કૃષ્ણ ભગવાનને કળીયુગનું મહાતીર્થ ધામ બનાવવા,કુંવારિકા ભુમીની સ્થાપના કરી હતી.તો આજે તે કળીયુગનું મહા તીર્થ ધામ એટલે પ્રેરણા પીઠ પીરાણા ધામ, કુવારીકાક્ષેત્ર છે. તો કૃષ્ણના જ અવતાર શ્રી કલ્કી ભગવાનનું ધામ એ જ છે. ત્યાંથી ઉત્તર ડીસાએ સરસ્વતી નદી કિનારે, અને પાવડી આરે,કળીયુગના અંતે કુળક્ષેત્ર જેવું,કળીયુગનું મહાધર્મ યુદ્ધ થવાનું છે. તેમાં આજના દઈત કાળીંગાને મારી,શ્રી કલ્કી ભગવાન દુષ્ટોનો નાશ કરશે.અને કળીયુગ ઉથાપી,કળીયુગની સમાપ્તી કરશે.ત્યારે નવી સૃષ્ટીની સ્થાપના કલ્કી ભગવાન કરશે એવું શાસ્ત્રો કહે છે.

કળીયુગમાં શ્રી કલ્કી ભગવાન વિષ્ણુંનો દશમાં રૂપે અવતાર સત્ય છે. તેથી જ ગામો ગામ આપણા મંદિરોમાં,કલ્કી ભગવાનનાં દશમાં રૂપે આજે આપે એમના ફોટા લગાવીએ છીએ. એ જગ જાહેર વાત છે. છતાં પણ એ વાત સમજાતી નથી.એ આપણું દુર્ભાગ્ય છે.માટે જાણી જોઈને આપે અંધા બન્યા છીએ.તો કલ્કી ભગવાન જયારે પ્રગટ થશે.ત્યારે સતપંથના વિરોધ બદલ સનાતન સમાજનો ખુબ ખુબ પસ્તાવો થશે,એ નક્કી માનજો. પાંડવોએ કૌરવોનું દુ:ખ સહન કર્યું હતું.તેથી શ્રી કૃષ્ણ કૃપાથી પાંડવોની જીત થઈ હતી.તેવી જ રીતે આજે,સતપંથી ઉપર જોર જુલમી કરી,સનાતન સમાજ તેને હેરાન કરી રહી છે.તેથી આજના કર્તા નારાયણ શ્રી

https://archive.org/details/bk1033/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v7.py

Real Patidar
Unravel Truth
Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.20 16:23:05 +05'30'

05-Aug-2019

શ્રી લક્ષ્મી નારાયણાયે નમ:

realpatidar.com

શ્રી ઉમીયા માતાયે નમ:
લોનાવલા.તા.૫-૮-૧૯.

શ્રી અખીલ ભારતીય કચ્છ કડવા પાટીદાર, સનાતન સમાજ, નખત્રાણા, કચ્છ.
લખનાર લોનાવલાથી મુંબઈના સનાતન સમાજનું એક યુવક મંડળ.

જય શ્રી ઉમીયા માતાજી સાથે જણાવવાનું કે, અમો અખીલ કચ્છ કડવા પાટીદાર, સનાતન સમાજના જ સભ્યો છીએ. આપણી પાટીદાર સમાજમાં જે,સનાતન તથા સતપંથ સામાજોમાં જે,ધર્મના નામે ઝઘડાઓ ચાલી રહ્યા છે.તેમાં અમો નવ-દશ વર્ષથી બંન્ને સામાજોનો અભ્યાસ કરી રહ્યા છીએ. સતપંથ ધર્મમાં જે સુધારાની જરૂર હતી,તે સુધારા થઈને એ વેદ અને સનાતન ધર્મના આધારે યોગ્ય બન્યું છે. પરંતુ આપણા સનાતન ધર્મમાં નથી કોઈ શાસ્ત્રો અને નથી કોઈ ચોક્કસ ધર્મના નિતી નિયમો.તેથી નથી સનાતન સમાજનો કોઈ સાચી ડીસા. તેથી જ સનાતન સમાજ વિવેકનો માનવતા મુકી મનફાવે તેમ,એ સતપંથની નીંદા કરી પાપ વોરી રહી છે. તેનું અમોને દુ:ખ છે. સનાતનનું આજે બહુમત હોવાથી સતપંથ માટે ખોટા નિયમ બનાવી રહી છે. જેથી સમાજની નિયાણીંયું બહુ દુ:ખી છે.તો એ નિયાણીયુંએ સમાજનું શું બગાડયું છે કે,વિવાહ જેવા સુભ પ્રસંગમાં, બેનના ઘરે જો ભાઈ પ્રેમથી ટાઈમ પર આવી ન શકે.અને ટાઈમ ઉપર મામેરૂં પણ આપી ન શકે તો,એ ચોખે ચોખો અન્યાય છે. આથી નિર્દોષ નિયાણીંની હાય સમાજનો જરૂર લાગવાની છે. માટે એ ભોગવવું જ પડશે. બીજુ સતપંથી સાથે ધંધાકીય વ્યવહાર કરવા નહીં.અને તેમની સાથે ભાગીદારી કરવી નહીં.અને જો હોય તો,તે ભાગીદારી છુટી કરી લેવી. આવા આવા અનેક ખોટા નિયમો બનાવી વિવેક અને માનવતા વિરૂદ્ધના નિયમો બનાવે છે. તેથી સનાતન સમાજનો સુજ્યું છે શું, એ જ સમજાતું નથી.અને આપે કહીએ છીએ કે, સનાતન સમાજે જો,શ્રી લક્ષ્મી નારાયણ સનાતન ધર્મ અપનાવ્યો નાં હોત,તો આજે આપણી પાટીદાર સમાજ મુસલમાન બની ગઈ હોત.પરંતુ હકીકતમાં એનાથી આજે બધું જ ઉંધુ બની રહ્યું છે.કારણ આપે સતપંથ મુકીને શ્રી લક્ષ્મી નારાયણ સનાતન ધર્મ અપનાવ્યો છે.તેથી જ આપણા નવયુવાનિયાઓ આજે ન ખાવાનું,કે ન પીવાનું,મુસલમાન સાથે બેસી ખાઈ પી રહ્યા છે.ત્યારે સતપંથમાં આવું કાંઈપણ નથી. આવી વસ્તુથી સતપંથી દુર રહે છે.તો મુસલમાન કોણ બની રહ્યું છે. આપે કે સતપંથી ? તેનો વિચાર કરવા જેવો છે. સાચા સતપંથીઓ તો હોટલનું પાણી પણ પીતા નથી.તેથી જ તે પોતાનું હિન્દુત્વ સાચવી રહ્યા છે.ત્યારે આપે ના ખાવાનું ને ન પીવાનું પીને, આપે હિન્દુત્વ ગુમાવી રહ્યા છીએ. દારૂથી તો અનેકનાં ઘર બદબાદ બની રહ્યા છે.છતાં આપણી આંખો ખોલતી નથી. ખરેખર સતપંથ મુકવાથી જ આપણા આવા હાલ થયા છે, સમજી લેજો. તો કયાં ગયું આપણું હિન્દુત્વ, કે જે હિન્દુત્વ માટે આપે સતપંથ ધર્મનો છોડયો છે.

કળીયુગમાં નારાયણ વિષ્ણુંવેદ આધારે,અને સનાતન ધર્મના આધારે,દશમાં રૂપે શ્રી કલ્કી ભગવાનના રૂપમાં થવાના છે. તેથી સતપંથી આજે પુજે છે. છતાં પણ આપે સતપંથની નીંદા કરી રહ્યા છીએ. તેથી જ આપણું નુકશાન છે.કારણ સતપંથ ઉપર ખોટા વ્યવહારીક દબાણો મુકી,સતપંથીઓને ધર્મ છોડવી,અને આપે શ્રી કલ્કી ભગવાનનાં મંદિર બંધ કરાવી રહ્યા છીએ.માટે એ ભોગવવું જ પડશે.તો હંમેશા ધર્મનો જય થાય છે.અને અધર્મનો નાશ થાય છે. શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે, જયારે જયારે ધર્મની હાની થાય છે.અને અધર્મની વૃધ્ધિ થાય છે.ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરૂં છું.ત્યારે સતપુરૂષોનું રક્ષણ કરવા,દુષ્ટોનો નાશ કરવા,અને ધર્મનો ફરી સ્થાપવા યુગે યુગે હું પ્રગટ થાઉં છું. પાંડવોની અજ્ઞાત વાસામાં વેરાટ નગરીમાં, શ્રી કૃષ્ણ આજના ધોળકા ગામે પાંડવોને મળવા ગયા હતા.ત્યારે ધોળકાની નજીકમાં ગીરમટા ગામે અને સાબરમતી નદીના પુર્વ કિનારે,શ્રી કૃષ્ણ ભગવાનને કળીયુગનું મહાતીર્થ ધામ બનાવવા,કુંવારિકા ભુમીની સ્થાપના કરી હતી.તો આજે તે કળીયુગનું મહા તીર્થ ધામ એટલે પ્રેરણા પીઠ પીરાણા ધામ, કુવારીકાક્ષેત્ર છે. તો કૃષ્ણના જ અવતાર શ્રી કલ્કી ભગવાનનું ધામ એ જ છે. ત્યાંથી ઉત્તર ડીસાએ સરસ્વતી નદી કિનારે, અને પાવડી આરે,કળીયુગના અંતે કુળક્ષેત્ર જેવું,કળીયુગનું મહાધર્મ યુદ્ધ થવાનું છે. તેમાં આજના દઈત કાળીંગાને મારી,શ્રી કલ્કી ભગવાન દુષ્ટોનો નાશ કરશે.અને કળીયુગ ઉથાપી,કળીયુગની સમાપ્તી કરશે.ત્યારે નવી સૃષ્ટીની સ્થાપના કલ્કી ભગવાન કરશે એવું શાસ્ત્રો કહે છે.

કળીયુગમાં શ્રી કલ્કી ભગવાન વિષ્ણુંનો દશમાં રૂપે અવતાર સત્ય છે. તેથી જ ગામો ગામ આપણા મંદિરોમાં,કલ્કી ભગવાનનાં દશમાં રૂપે આજે આપે એમના ફોટા લગાવીએ છીએ. એ જગ જાહેર વાત છે. છતાં પણ એ વાત સમજાતી નથી.એ આપણું દુર્ભાગ્ય છે.માટે જાણી જોઈને આપે અંધા બન્યા છીએ.તો કલ્કી ભગવાન જયારે પ્રગટ થશે.ત્યારે સતપંથના વિરોધ બદલ સનાતન સમાજનો ખુબ ખુબ પસ્તાવો થશે,એ નક્કી માનજો. પાંડવોએ કૌરવોનું દુ:ખ સહન કર્યું હતું.તેથી શ્રી કૃષ્ણ કૃપાથી પાંડવોની જીત થઈ હતી.તેવી જ રીતે આજે,સતપંથી ઉપર જોર જુલમી કરી,સનાતન સમાજ તેને હેરાન કરી રહી છે.તેથી આજના કર્તા નારાયણ શ્રી

realpatidar.com

https://archive.org/details/bk1033/page/n3/mode/1up

realpatidar.com

કૃષ્ણના જ અવતાર શ્રી કલ્કી ભગવાનની કૃપાથી, આપણા આ સનાતન અને સતપંથના ધર્મ યુધ્ધના ઝઘડામાં, કલ્કી ભગવાનની કૃપાથી, સતપંથ ધર્મની જરૂર જીત થશે. એવું લાગે છે. કારણ સતપંથ વેદ આધારે જ છે. તો નીચે બે ફોટા આપ્યા છે તે ઉપરથી સમજાશે. યુગ પ્રમાણે શ્રી કલ્કી ભગવાને સતપંથી પુજી રહ્યા છે. ત્યારે આપે તેમની નીંદા કરી રહ્યા છીએ. તેથી જીત સતપંથીની જ થવાની છે. બસ એ જ કહેવું છે. માટે ચેતનારા ચેતજો અને સતપંથનો વિરોધ છોડજો. અમો સનાતન સમાજના જ સભ્યો છીએ. પણ સનાતન સમાજ જ્યારે, સતપંથના વિરોધમાં ખોટા નિયમો બનાવે છે. ત્યારે અમો તેનો વિરોધ કરીએ છીએ. આજે અમો મુંબઈથી લોનાવલા આવી મીટીંગ ભરી આ ટપાલ લખેલ છે. કદાચ આ ટપાલમાં સમાજ વિશે, વધુ લખાણું હોય તો ક્ષમા.

લી. લોનાવલાથી મુંબઈનું સનાતન સમાજનું એક યુવક મંડળના જય શ્રી લક્ષ્મી નારાયણ.



કલીયુગમાં આદ નારાયણ વિષ્ણુ ભગવાન વેદ આધારે, કલ્કી રૂપે થવાના છે. તેથી કલ્કી ભગવાનને સતપંથી નિષ્કલંકી રૂપે પુજી રહ્યા છે. અને આપે તેની નીંદા કરી રહ્યા છીએ. એ જ આપણી ભુલ છે. અને એજ આદ નારાયણને આપે, શ્રી લક્ષ્મી નારાયણના રૂપમાં પુજી રહ્યા છીએ. તો પછી બન્ને સમાજો આદ નારાયણને જ પુજી રહ્યા છે. તો પછી આ ઝગડાઓ શા માટે છે. તે સમજાતું નથી. કદાચ પોરાણાવાળા કલ્કી ભગવાન જો બનાવટી હોય, તો કલ્કી ભગવાનનાં સાચા ઠામ ઠેકાણા, વેદ આધારે ક્યાં છે. તે સનાતન સમાજ શોધી કાઢે. તો જ પોરાણાવાળા કલ્કી ભગવાન બનાવટી છે. એમ કહી શકાય. જો તે વેદ આધારે શોધી ન શકાય, તો પછી પોરાણાવાળા જ કલ્કી ભગવાન સાચા છે, એમ માનવું પડે. સનાતન સમાજે એ વિચારવું જોઇએ કે, આપે સતપંથની ખોટી રીતે નીંદા તો કરી રહ્યા નથી ને? કારણ શ્રી રામના વખતમાં પણ, ખોટી રીતે રામની પણ નીંદા દુનિયાએ કરી હતી. તેવી જ રીતે આપે પણ આજે ખોટી રીતે તો નીંદા કરતા નથી ને? કારણ વેદ આધારે આજે, કલ્કી ભગવાન નારાયણ વિષ્ણુના અવતાર છે. તેથી જ આપણા શ્રી લક્ષ્મી નારાયણના મંદિરોમાં દશમા રૂપે, શ્રી કલ્કી ભગવાનને આપે મુકીએ છીએ. પણ આજે સનાતન સમાજના કાર્યકર્તા ભાઈઓને મધુરો થયો છે. એમને આ વાત સમજાશે નહિં. કારણ એ લોકોના મગજમાં ખોટો જ સતપંથ ધર્મ ઘુસી ગયો છે. એ નીકળે એમ નથી. પરંતુ યુવાસંઘ, અને મહિલા મંડળ આનો વિચાર કરશો. કારણ સતપંથમાં સુધારા વધારા થઇ, સતપંથ ધર્મ ચોખ્ખું હિન્દુ સનાતન ધર્મ બની ગયું છે. તેથી જ ભારત ભરના સાધુ સંતોએ, સતપંથને હિન્દુ સનાતન ધર્મની માનતા આપી દીધી છે. ઉપર આપેલ ફોટાં સતપંથ યજ્ઞ વિધીનાં છે. તેથી સમજાય છે કે, સતપંથ ધર્મ બ્રહ્મા વિષ્ણુ મહેશ આદ્યશક્તિ અને કલ્કી ભગવાનને જ, વેદ આધારે પુજી રહ્યા છે. જે આજે પુજવા યોગ્ય છે. અને તેનીજ આપે નીંદા કરી રહ્યા છીએ. તો એ યોગ્ય નથી. માનવીએ મૃત્યુ બાદ પણ કરેલા કર્મોનો હિસાબ પરમાત્મા પાસે આપવો પડે છે. તો જીવાત્માએ સારા કર્મો કરવા જોઇએ. માટે સતપંથની નિંદા છોડજો, ને પાપથી બચજો. બસ એજ વિનતી.

લી. મુંબઈનું એક સનાતન યુવક મંડળ

realpatidar.com